



DBJ-007-1015001

Seat No. _____

B. Sc. (Sem. V) (CBCS) (W.E.F. 2016) Examination

June - 2022

Home Science : Paper-1

(Canteen Management)

(General Option) (Old Course)

Faculty Code: 007

Subject Code: 1015001

Time : 2 Hours]

[Total Marks : 50

સૂચના : (1) કોઈપણ પાંચ પ્રશ્નના જવાબ આપો.
(2) બધા પ્રશ્નોના ગુણ સમાન છે.

- 1 કેન્ટીન મેનેજમેન્ટના સિદ્ધાંતો સમજાવો. 10
- 2 કેન્ટીન મેનેજમેન્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. 10
- 3 કેન્ટીનમાં મેનેજર અને હેલ્પર માટે ટ્રેનિંગની જરૂરિયાતની ચર્ચા કરો. 10
- 4 કેન્ટીનમાં વાનગીની કિંમતને અસરકર્તા પરિબલો જણાવો. 10
- 5 કેન્ટીનની આંતરિક સજાવટમાં પ્રકાશ, બારીના પડદા, ફલાવર એરેન્જમેન્ટ અને ટેબલ સેટીંગની પસંદગી સમજાવો. 10
- 6 હિસાબ-કિતાબના હેતુઓ અને તેના પ્રકારોની ચર્ચા કરો. 10
- 7 મેનુ પ્લાનિંગના પ્રકારો જણાવો. 10
- 8 ફૂડની ખરીદી અને સંગ્રહ વિશે લખો. 10
- 9 મેનુનો અર્થ આપી કેન્ટીન મેનેજમેન્ટમાં મેનુ પ્લાનિંગના સિદ્ધાંતો સમજાવો. 10
- 10 ટૂંકનોંધ લખો : (કોઈપણ બે) 10
 - (1) કેન્ટીન મેનેજમેન્ટની વિશેષતાઓ
 - (2) ફૂડ-હાઈજીન અને સેનિટેશન (સ્વચ્છતા)
 - (3) ફૂડ સર્વિસના પ્રકાર
 - (4) ફૂડ કોસ્ટ કંટ્રોલનું મહત્ત્વ

ENGLISH VERSION

Instructions:

- (1) Answer any five questions.
- (2) All question carry equal marks.

- | | | |
|-----------|---|-----------|
| 1 | Explain the principles of canteen management | 10 |
| 2 | State the essential steps to be consideration in canteen management. | 10 |
| 3 | Discuss the need of training of manager and helper in canteen management. | 10 |
| 4 | Write the factors affecting the food cost in canteen. | 10 |
| 5 | Explain the selection of lighting, window curtains, flower arrangement and table setting in interior decoration of canteen. | 10 |
| 6 | Discuss the objective of account keeping and its types. | 10 |
| 7 | State the types of menu planning. | 10 |
| 8 | Write about purchasing and storage of food. | 10 |
| 9 | Give the meaning of menu planning and explain the principles of menu palnning in canteen management. | 10 |
| 10 | Write short note: (any two) | 10 |
| | (1) Characteristic of canteen management | |
| | (2) Food-Hygiene and sanitation | |
| | (3) Types of food services | |
| | (4) Importance of food cost control. | |